



જુલાઈ 13, 2018

## એનબ્રિજ ગેસ ડિસ્ટ્રિબ્યુશન આગ અને કાર્બન મોનોક્સાઈડ સંબંધિત મૃત્યુને પ્રોજેક્ટ ઝીરો મારફતે ઘટાડવા બ્રામ્પટન ફાયર અને ફાયર માર્શલની પબ્લિક ફાયર સેફ્ટી કાઉન્સિલને મદદ કરે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – આજે, એનબ્રિજ ગેસ ડિસ્ટ્રિબ્યુશન, ફાયર માર્શલની પબ્લિક ફાયર સેફ્ટી કાઉન્સિલ અને બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસે ઘોષણા કરી કે તેઓ ઘરેલું સુરક્ષા સુધારવા અને આગ અને કાર્બન મોનોક્સાઈડ સંબંધિત મૃત્યુ ઘટાડીને શૂન્ય કરવા માટે ભાગીદારી કરી રહ્યા છે.

બ્રામ્પટન ફાયરને પ્રોજેક્ટ ઝીરો મારફતે 762 જેટલા કોમ્બિનેશન સ્મોક અને કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ મળ્યા – એક જાહેર શિક્ષણ ઝુંબેશ જે 30 જેટલી ઓન્ટેરિયો મ્યુનિસિપાલિટીસમાં રહેવાસીઓને 6,600 થી વધારે એલાર્મ્સ પૂરા પાડી રહ્યું છે. આ વર્ષે, એનબ્રિજ પ્રોજેક્ટ ઝીરોમાં \$200,000 નું રોકાણ કર્યું. 2009 થી, પ્રોજેક્ટ ઝીરોના ભાગ રૂપે 34,384 એલાર્મ્સ ઓન્ટેરિયોને પૂરા પાડવામાં આવ્યા છે.

યોગ્ય રીતે ઈન્સ્ટોલ અને જાળવણી કરવામાં આવે ત્યારે, કોમ્બિનેશન સ્મોક એન્ડ કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ વહેલી ચેતવણી આપવામાં મદદરૂપ થાય છે જે ઘરેલું આગ કે કાર્બન મોનોક્સાઈડ સામે ઉઘાડા પડવામાં સુરક્ષિતપણે બચવા માટે જરૂરી બને છે.

કાર્બન મોનોક્સાઈડ એક ઝેરી, ગંધહીન વાયુ છે જે ઘણાં પ્રકારના સામાન્ય ઈંધણોના અધૂરા બળતણની આડપેદાશ છે. એ મહત્વનું છે કે કાર્બન મોનોક્સાઈડ બનતો અટકાવવા ઈંધણ-બાળતા સાધનની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવે. કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સની ભલામણ કાર્બન મોનોક્સાઈડ ઝેરના ભય સામે સંરક્ષણ મેળવવા બીજી શ્રેણીના બચાવ તરીકે કરવામાં આવે છે.

“અમારી પાસે પુરાવો છે કે રોકથામ જીવન બચાવે છે. આ જાણીને, અમે અમારા ગ્રાહકોને કોમ્બિનેશન સ્મોક એન્ડ કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ, તેમજ યોગ્ય જાળવણી કરવાનું ઈંધણ-બાળતું સાધન ઈન્સ્ટોલ કરવાના મહત્વ વિશે શિક્ષિત કરવા કટિબદ્ધ છીએ,” એનબ્રિજ ગેસ ડિસ્ટ્રિબ્યુશનના ગ્રાન્ટ કિલપેટ્ટ્રિકે કહ્યું.

“એ અનિવાર્ય છે કે ઓન્ટેરિયોના નાગરિકો કાર્બન મોનોક્સાઈડના ઝેર સામે પોતાનું અને પોતાના કુટુંબીજનોનું સંરક્ષણ કરે,” ઓન્ટેરિયોના ફાયર માર્શલ અને ફાયર માર્શલની પબ્લિક ફાયર સેફ્ટી કાઉન્સિલના પ્રમુખ રોસ નિકોલસે કહ્યું. “પોતાના ઘરમાં દરેક સ્તરે અને સૂવાની જગ્યા નજીક કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ ઈન્સ્ટોલ કરીને - રહેવાસીઓ બિનજરૂરી દુઃખદ ઘટનાઓ ટાળવામાં મદદ કરી શકે છે. પ્રોજેક્ટ ઝીરો આણમોલ કાર્યક્રમ છે જે ફાયર ડિપાર્ટમેન્ટ્સને પોતાના સમુદાયમાં રહેવાસીઓને કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ વિશે શિક્ષિત કરવામાં મદદરૂપ થાય છે.”

“આ મહાન કાર્યક્રમના પરિણામસ્વરૂપે, આપણી પાસે બ્રામ્પટન રહેવાસીઓને વધારે સ્મોક અને કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ પૂરા પાડવાની તક છે,” બ્રામ્પટનના મેયર લિન્ડા જેફરીએ કહ્યું. “આપણે જાણીએ છીએ કે તેઓ જીવન બચાવે છે અને આપણાં રહેવાસીઓની સુરક્ષા બ્રામ્પટન ફાયર માટે અને શહેર માટે એક અગ્રતાની બાબત છે.”

“અમે આ જીવ-બચાવતા એલાર્મ્સના ઉદાર દાન માટે એનબ્રિજ અને ફાયર માર્શલની પબ્લિક ફાયર સેફ્ટી કાઉન્સિલના આભારી છીએ,” બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ચીફ બિલ બોયસે કહ્યું. “અમારા કર્મચારીઓ સમુદાયો સુધી પહોંચે એટલે તેઓ આ એલાર્મ્સની જરૂરિયાત ધરાવતા ઘરોને તે વહેંચી શકશે, અને અમે આ એલાર્મ્સ મેળવનાર અન્ય લોકોની જેમ અમારા “હોટ ઝોન” પ્રોગ્રામ મારફતે કેટલાક સંભવિતપણે બહુ ઊંચું જોખમ ધરાવતા અને ભેદ સમૂહો ઓળખી કાઢ્યા છે.”

## ફાયર માર્શલની પબ્લિક ફાયર સેફ્ટી કાઉન્સિલ વિશે

ફાયર માર્શલની પબ્લિક ફાયર સેફ્ટી કાઉન્સિલ (કાઉન્સિલ) 1993 માં સ્થાપિત નોંધાયેલી ચેરીટી છે જેઓનું લક્ષ્ય “આગથી કોઈને ઈજા ન થાય તેવી દુનિયા” બનાવવામાં મદદરૂપ થવાનું છે. પ્રમુખપદે ઓન્ટેરિયો ફાયર માર્શલ, અને ફાયર માર્શલ અને ઈમરજન્સી મેનેજમેન્ટની ઓફિસની સહાય મેળવીને, કાઉન્સિલ જાહેર સુરક્ષામાં રસ ધરાવતા વિવિધ સમૂહો અને લોકો સાથે પ્રાયોજક બનીને અને તેઓની ભાગીદારીમાં આગ રોકથામ અને જાહેર શિક્ષણને પ્રોત્સાહન આપે છે. કાઉન્સિલને Twitter પર અનુસરો, @FMPFSC.

## બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સેવાઓ વિશે

બ્રામ્પટન એક કંપાયમાન, વૈવિધ્યસભર અને વિકસી રહેલો સમુદાય છે, અને બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ પોતાના સમુદાયને અપવાદમય સેવા આપવાની લાંબી પરંપરા ધરાવે છે. પોતાના મૂળનું પગલું 1853 માં બ્રામ્પટનની પહેલી ફાયર બ્રિગેડ સુધી શોધતા, ડિપાર્ટમેન્ટે બ્રામ્પટન શહેર અને રહેવાસીઓને 150 ઉપરાંત વર્ષોથી ગૌરવમય અને નવીનતમ સેવા આપી રહ્યું છે. ડિપાર્ટમેન્ટની ઓળખ અગ્નિશમન સેવાઓમાં આગેવાન તરીકે થાય છે, જે નવી પહેલો, તાલીમ, દાવપેચ અને ટેકનોલોજી લાવીને જીવન અને મિલકતનું સંરક્ષણ કરવામાં મદદરૂપ થાય છે.

## એનબ્રિજ ગેસ ડિસ્ટ્રિબ્યુશન વિશે

એનબ્રિજ ગેસ ડિસ્ટ્રિબ્યુશન ઈન્ક.નો ઇતિહાસ 170-વર્ષ જૂનો છે અને કેનેડાની સૌથી વિશાળ કુદરતી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. જે એનબ્રિજ ઈન્ક.ની માલિકીની છે, જે ઊર્જા પરિવહન અને વહેંચણીમાં કેનેડા સ્થિત આગેવાન છે, અને ગત નવ વર્ષો માટે વૈશ્વિક 100 સૌથી સ્થિર કોર્પોરેશન્સમાંના એકનો દરજ્જો મેળવ્યો છે. એનબ્રિજ ગેસ ડિસ્ટ્રિબ્યુશન ઓન્ટેરિયોમાં બે મિલિયન ઉપરાંત ગ્રાહકોને કુદરતી ગેસ વહેંચે છે. વધુ માહિતી માટે, વેબસાઈટ [www.enbridgegas.com](http://www.enbridgegas.com) જુઓ અથવા અમને Twitter પર અનુસરો, @EnbridgeGas.

-30-

## વધુ માહિતી માટે, કૃપા કરી સંપર્ક કરો:

કેથી એશ (Kathy Ash), ફાયર માર્શલની પબ્લિક ફાયર સેફ્ટી કાઉન્સિલ

ફોન: 1-866-379-6668 એક્ટેન્શન 105

ઈમેલ: [kathy.ash@firesafetycouncil.com](mailto:kathy.ash@firesafetycouncil.com)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill), મીડિયા કોર્ડિનેટર, સીટી ઓફ બ્રામ્પટન

ફોન: 905-874-3654

ઈમેલ: [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)

અકિલાહ ડ્રેસેકી (Akilah Dressekie), એનબ્રિજ ગેસ ડિસ્ટ્રિબ્યુશન

ફોન: 1-855-884-5112

ઈમેલ: [enbridgegasmedia@enbridge.com](mailto:enbridgegasmedia@enbridge.com)